



બ્રેમ્પટન સીટી હોલ અને સવલતોનો બંધ COVID-19ના પ્રતિસાદરૂપે આગામી સૂચના મળે ત્યાં સુધી લંબાવવામાં આવ્યો છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (27 માર્ચ 2020) – પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શી હેઠળ અને આપણા નાગરિકો અને કર્મચારીઓની સલામતી માટે, સિટી હોલ અને સિટી ઓફ બ્રેમ્પટનની અન્ય સવલતો આગામી સૂચના મળે ત્યાં સુધી બંધ રહેશે જેથી COVID-19નો ફેલાવો રોકવામાં મદદ મળે.

સિટી-સવલતો બંધ કરવા બાબતે

સિટી હોલ, રિક્લિએશન અને કમ્યુનિટી સેન્ટરો તેમજ બ્રેમ્પટન પુસ્તકાલયની શાખાઓ આગામી સૂચના સુધી બંધ રહેશે.

સિટી હોલ ખાતેની 24-કલાકની લોબી (એલિવેટર પાસે, પાર્કિંગ ટિકીટ મશીન અને ચેક ડ્રોપ બોક્સ) ખુલ્લી રહેશે અ તેના પર વારંવાર ટેમ્પરેચ રાખવામાં આવશે.

સિટી દ્વારા ચલાવાતા ઈવેન્ટ્સ

તમામ સિટી દ્વારા આયોજિત ઈવેન્ટ્સ આગામી સૂચના સુધી રદ કરવામાં આવ્યા છે. સિટીની સવલતોમાં આ સમયગાળામાં યોજાયેલ તમામ સામાજિક પ્રસંગો પણ રદ કરવામાં આવે છે.

રિક્લિએશન પ્રોગ્રામિંગ

તમામ રિક્લિએશન પ્રોગ્રામિંગ અને રેન્ટલો આગામી સૂચના સુધી રદ કરવામાં આવે છે. ક્રેડિટ્સ આપોઆપ ખાતાઓમાં મુકી દેવામાં આવશે. કૃપા કરી વધુ માહિતી માટે reconnects@brampton.caનો સંપર્ક કરો.

દ રોજ બ્રેમ્પટન

સિટી ઓફ બ્રેમ્પટન પરફોર્મિંગ આર્ટ્સ વેન્યુ પર ગોઠવાયેલ તમામ ઈવેન્ટ્સ રદ કરવામાં આવ્યા છે અથવા મોકૂફ કરવામાં આવ્યા છે. વધુમાં મે મહિનામાં થનાર ખેલ સહિત દ રોજ પ્રેઝન્ટ્સ 2019-2020 સિઝન, નો બાકીનો ભાગ પણ રદ અથવા મોકૂફ રાખવામાં આવેલ છે. જાહેર જનતા માટે પરફોર્મિંગ આર્ટ્સ વેન્યુ આગામી સૂચના સુધી બંધ રહેશે.



વધુ જાણકારી માટે, કૃપા કરીને મુલાકાત લો www.therosebrampton.ca અથવા ઈમેલથી અહીં બોક્સ ઓફિસનો સંપર્ક કરો boxoffice@brampton.ca.

અતિમહત્વપૂર્ણ સેવાઓ

તમામ અતિમહત્વપૂર્ણ સેવાઓ આપણા સમાજને મદદરૂપ થવા સામાન્ય રીતે કાર્ય કરશે જેમાં સામેલ છે ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ, બ્રેમ્પ્ટન ટ્રાન્ઝિટ, બાય-લો એન્ફોર્સમેન્ટ, માર્ગ પ્રચાલન, POA કોર્ટ્સ એન્ડ સિક્યોરિટી સર્વિસિસ.

બ્રેમ્પ્ટન એનિમલ શેલ્ટર જાહેર જનતા માટે બંધ છે અને દત્તક લેવા અને રિક્વેઈર્મ્સ ફક્ત એપોઈન્ટમેન્ટ દ્વારા થાય છે.

કોર્ટ એડમિનિસ્ટ્રેશનમાં રહેલ સૂપરવાઈઝરો પ્રત્યેક દિવસે માત્ર મર્યાદિત કલાકો સુધી કાયદાકીય સમયસીમાઓ અનુસાર એન્ફોર્સમેન્ટ એજન્સીઓમાંથી ફાઈલિંગ સ્વીકારવા માટે ઓફિસમાં હશે. આ હેતુ માટે સવલતના મુખ્ય પ્રવેશ પર ડ્રોપ બોક્સની સુવિધા છે. આવશ્યકતા અનુસાર તે પબ્લિક ફાઈલિંગ્સ માટે પણ ઉપલબ્ધ છે.

આપણા અને કર્મચારીઓના આરોગ્યનું રક્ષણ કરવા માટે સિટીએ બસોમાં, સવલતોમાં અને ટર્મિનલોમાં કઠણ સપાટીઓ અને બેઠકોને સાફ કરવાના અને જંતુમુક્ત કરવાના આવર્તનોમાં વધારો કરાયો છે.

સીટી ઓફ બ્રેમ્પ્ટન COVID-19 સામેના પ્રતિસાદરૂપે કટોકટીની સ્થિતિ

24 માર્ચ 2020ના રોજ સિટી કાઉન્સિલ સાથે સલાહમસલત કર્યા બાદ અને સિટીની ઈમર્જન્સી મેનેજમેન્ટ ટીમની ભલામણને ધ્યાન પર લઈને મેયર પેટ્રિક બ્રાઉને સિટીના ઈમર્જન્સી મેનેજમેન્ટ પ્લાન અનુસાર સીટી ઓફ બ્રેમ્પ્ટનમાં કટોકટીની સ્થિતિની ઘોષણા કરેલ છે. આ ઘોષણા, COVID-19ના પ્રભાવોને રોકવામાં સહાય માટે કાર્યવાહી કરવાને કારણે વધુ સુગમતા અને ગતિને મંજૂરી આપીને શહેરની ચાલી રહેલ કટોકટીના પ્રતિસાદના પ્રયાસોમાં મદદ કરશે.

સિટી ઓફ બ્રેમ્પ્ટન COVID-19 ને ગંભીરતાથી ધ્યાન પર લે છે અને પીલ પબ્લિક હેલ્થની સલાહ અનુસરવાનું ચાલુ રાખે છે. સૌથી અદ્યતન માહિતી અહીં ઉપલબ્ધ છે www.peelregion.ca/coronavirus. સિટી આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે અને વધુ માહિતી ઉપલબ્ધ થતાંની સાથે અપડેટ્સ પૂરા પાડશે. અપડેટ્સ માટે મહેરબાની કરી અહીં મુલાકાત લો www.brampton.ca/COVID19.

-30-

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूडान्मक संवाढ

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca